LLP Act, 2008 read with Rule 17 of the LLP Rules, 2009 AND In the matter of YASH TEXFAB LLP having its registered office at F-2/3, NAVAPUR MIDC, NAVAPUR INDUSTRIAL AREA, NAVAPUR, NANDURBAR, MAHARASTRA-425418.

Notice is hereby given to the General Public that the LLP proposes to make application to the Central Government under section 13 of the LLP Act, 2008 seeking confirmation of alteration of the Supplementary Agreement in terms of the special resolution passed at the Board Meeting held on 15TH MAY, 2023 to enable the LLP to change its Registered office from "State of Gujarat" to "State of Maharastra".

Any person whose interest is likely to be affected by the proposed change of the registered office of the LLP may deliver or cause to be delivered or send by registered post of his/her objections supported by an affidavit stating the nature of his/her interest and grounds of opposition to the Yash Texfab LLP within Fourteen days from the date of publication of this notice with a copy of the applicant company at its registered office at the address mentioned below

Arya A- 102, Punyabhoomi, Near Bhagwan Mahavir College, Second VIP Road, VESU, Surat.

For and on behalf of the Applicant. YASH TEXFAB LLP Director Name: SUNIL KUMAR GARG.

Dated: 27/05/2023, Place : Surat

Bharuch Region Office: Sky Line Building, College Road Bharuch Phone No. 02642 205034, 205035

Email: recovery.bharuch@bankofbaroda.com

AUCTION OF SEIZED VEHICLE

Following Vehicles are seized and to be sold on 'As is where is' and 'As is what is' and 'Without Recourse' basis. Conditions for Realization of the secured debts due to Bank of Baroda. The Sale will be done by the undersigned through E-Auction Platform provided

at the website https://bob.auctiontiger.net. Auction Date: 12.06.2023, Auction Time: 2.00 To 5.00 P.m. Vehicle Inspection Date: 09.06.2023 & Time: 11.00 am to 4.00 pm at: Kosmadi, Ankleshwar

| Sr. No. | Branch | Name of Borrower | Vehicle Details | Dues (In Lacs) Incl. Int. upto 31.12.2022 | Reserve Price EMD BID increase Amt. | EMD Collection A/c. No. | IFSC Code | Contact Person Name & Number |
|------------|----------|---------------------|-------------------------|---|---|-------------------------------|--------------|---------------------------------|
| 1. | Jambusar | Chhatrasang | MAHINDRA | 5.77 Lacs | 4,30,000/- | 022200 | BARBO | Prasoon Kumar |
| | | Banesang Jadav | KUV 100 NXT K6+ 6S G | + Interest & Other charges | 43,000/- | 15181219 | JAMBUS | 8888119754 |
| | | | GJ 16 CN 8117 2020 | | 10,000/- | | | |
| 2. | Chavaj | Mehulkumar | MAHINDRA | 4.13 Lacs | 3,85,000/- | 106000 | BARBO | Branch Head |
| | | Mukeshbhai Patel | KUV 100 NXT K8 6S G | + Interest & Other charges | 38,500/- | 15181219 | CHAVAJ | 9099007411 |
| | | | GJ 16 CH 2698 | a omor onargoo | 10,000/- | | | |

(1) For detailed Terms and Conditions of the sale, please refer to the link provided in Bank of Baroda, Secured Creditor's website i.e. www.bankofbaroda.com/webcast.htm. (2) The Auction-Cum-Sale shall be conducted through e-Auction mode only, through the official portal of https://bob.auctiontiger.net. (3) The intending bidders are advised to go through the portal https://bob.auctiontiger.net for detailed Terms and Conditions for e-Auction Sale before submitting their bids and taking part in the e-Auction Sale proceedings and contact th respective Authorised Officer for the concerned Vehicle as mentioned above.

Place : Bharuch | Date : 26.05.2023 Authorised Officer, Bank of Baroda

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

Jivraj Park Branch

3A-3B, Amrutbaug Society, Jivraj Park, Ahmedabad - 380051, Gujarat, India Phone + 91 79 2682298 • Fax: 26822271 •

E AUCTION SALE NOTICE FOR SALE OF CAR E MAIL: jivraj@bankofbaroda.com • Web : www.bankofbaroda.com Sale Notice for Sale of Movable/Immovable Properties

[APPENDIX- II A with Rule 6 (2) for Movable] [APPENDIX IV-A refer proviso to 8 (6) for immovable Property] E-Auction Sale Notice for Sale of Movable/Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provision to Rule 6 (2) & 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s), Mortgagor (s) and Guarantor (s) that the below described Movable/ immovable property/ies Hypothecated/Mortgaged charged to the Secured Creditor, possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is basis for recovery of dues in below mentioned account/s. The details of Borrower/s/Mortgagor/Guarantor/s/Secured Asset/s/Dues/Reserve Price/e-Auction date & Time, EMD and Bid Increase Amount are entioned below

| | | | DESCRIPTION | OF THE VEHICLES A | 2 OUDEK | | |
|---|--|--|------------------------------------|---|--|---|---|
| | | Give short description of the Movable / immovable property with known encumbrances, if any | Total Dues. | 1. Date of e-Auction Time of E-auction - Start Time to End Time | (1) Reserve Price & (2) EMD Amount Deposit (3) Bid increase Amount | EMD deposit Account No. IFSC Code Bank of Baroda Branch | Status of Possession - Property Inspection date & Time. |
| 1 | Gohel 2965, Vankarvas, Vejalpur, Ahmedahad-380051 | Model: Hyundai EON Era+ Registration no: GJ01FT5163 *(Motorcab) Chassis no: MALA251ALHM5907434 Engine no. G3HAHM544225 RC-Xerox | Rs. 2,45,003.32/- + Interest | Date -29.06.2023 Time:- 12:00 to 16:00 | Reverse Price:- Rs. 80000/- EMD:- Rs. 8000/- Bid Increase Amt. Rs. 10000/- | Account No. 46850015181219 IFSC Code:- BARB0JIVRAJ Bank of Baroda, JIVRAJ Branch | Physical Possession Date -27.06.2023 Time:- 10:00 to 12:00 |

For detailed terms and conditions of sale, please refer/visit to the website link https://www.bankofbaroda.in/e-auction.htm and https://bob.auctiontiger.net/EPROC/ prospective bidders may contact the Authorised officer on Mobile 9785033111/9712944686 DATE: 25.05.2023, PLACE: AHMEDABAD **Authorised Officer, Bank of Baroda**

SAMBHAAV GROUP

SAMBHAAV MEDIA LIMITED

(CIN: L67120GJ1990PLC014094)

Registered Office: "Sambhaav House", Opp. Judges' Bungalows, Premchandnagar Road, Satellite, Ahmedabad - 380 015

Phone: +91 79 2687 3914/15/16/17

Email: secretarial@sambhaav.com Website: www.sambhaav.com EXTRACTS OF STANDALONE AND CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2023

| | | | | | | | | | | | (₹ in Lakhs) | |
|----|---|-----------------|------------------|-----------------|-----------------|----------------|-------------------|-----------------|---------------|-----------------|------------------|--|
| | | | Standalone | | | | | Consolidated | | | | |
| | | | Quarter Ended | | | Ended | nded Quarter End | | | Year I | r Ended | |
| SN | Particulars | 31-03-2023 | 31-12-2022 | 31-03-2022 | 31-03-2023 | 31-03-2022 | 31-03-2023 | 31-12-2022 | 31-03-2022 | 31-03-2023 | 31-03-2022 | |
| | (Refer Notes below) | Audited | Unaudited | Audited | Audited | Audited | Audited | Unaudited | Audited | Audited | Audited | |
| 1 | Total Income from Operations (net) | 1,151.48 | 1,006.50 | 1,090.94 | 4,020.90 | 3,364.35 | 1,151.48 | 1,018.85 | 1,114.93 | 4,033.25 | 3,397.40 | |
| 2 | Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional items | (128.28) | 20.21 | (102.10) | 9.74 | (408.86) | (178.05) | 3.56 | (62.28) | (66.32) | (396.45) | |
| 3 | Net Profit/ (Loss) for the period before tax (after Exceptional items) | (48.28) | 20.21 | (102.10) | 89.74 | (408.86) | (155.03) | 4.64 | (74.28) | (37.30) | (390.60) | |
| 4 | Net Profit/ (Loss) for the period after tax (after Exceptional items) | (73.38) | (1.44) | (70.76) | (14.06) | (314.59) | (170.17) | (12.83) | (42.43) | (124.51) | (295.82) | |
| 5 | Net Profit/(Loss) from discontinued operations after tax | (53.61) | (5.54) | 46.85 | (135.58) | 297.19 | (53.61) | (5.54) | 46.82 | (135.58) | 297.19 | |
| 6 | Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | (129.45) | (7.19) | (26.23) | (152.62) | (15.53) | (223.62) | (18.58) | 1.32 | (260.44) | 2.49 | |
| 7 | "Equity Share Capital (Face Value of ₹ 1/- per share)" | 1,911.11 | 1,911.11 | 1,911.11 | 1,911.11 | 1,911.11 | 1,911.11 | 1,911.11 | 1,911.11 | 1,911.11 | 1,911.11 | |
| 8 | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year | | | | 6,297.92 | 6,450.54 | | | | 6,349.20 | 6,609.64 | |
| 9 | Earning per share of ₹ 1/- each (from Continuing and Discontinuing Operations) | | | | | | | | | | | |
| | Basic and diluted EPS before Exceptional items (₹) -Continuing operations | (0.08) | (0.00) | (0.04) | (0.05) | (0.17) | (0.10) | (0.01) | (0.02) | (0.08) | (0.16) | |
| | Basic and diluted EPS before Exceptional items (₹) ·Discontinuing operations | (0.03) | (0.00) | 0.03 | (0.07) | 0.16 | (0.03) | (0.00) | 0.03 | (0.07) | 0.16 | |
| | Basic and diluted EPS after Exceptional items (₹) | (0.07) | (0.00) | (0.01) | (0.08) | (0.01) | (0.12) | (0.01) | 0.00 | (0.14) | 0.00 | |
| 1 | The above is an extract of the detailed format of Quarterly Financial F | Results reviewe | d by the Audit (| Committee and a | approved by the | Board of Direc | tors at their res | pective meeting | s held on May | 26, 2023 and th | ne same is filed | |

with the BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Financial Results for the Quarter and Year ended on March 31, 2023 together with notes thereto are available on the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.sambhaav.com Place: Ahmedabad For and on behalf of the Board of Directors Date : May 26, 2023

Manni B Vadodaria Managing Director DIN: 00092053

🕽 बैंक ऑफ़ बड़ीदा Bank of Baroda

Regional Office Hotel Skyline Building College Road, Bharuch - 392002 (Guiarat) Ph. 91 2642 205034/35

MEGA E-AUCTION

E-Auction Date : 13.06.2023

SALE NOTICE Time: 02 PM TO 06 PM with Extension of 10 minutes ि विजया VIJAYA E-mail: recovery.bharuch@bankofbaroda.com E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Security 8 Reconstruction of Financial Assets and Enforcement of Security

Interest Act, 2002 read with proviso to Rule 8(6) for Immovable and Rule 6(2) for Movables, of the Security Interest (Enforcement) Rule, 2002. creditor, the Possession of which has been taken by the Authorized Officers of the Bank of Baroda, Secured Creditor, will be sold on 'AS IS WHERE IS', 'AS IS WHAT IS' and 'WHATEVER THERE IS'

Basis for recovery of dues in below mentioned account/s. The details of Borrower(s), Mortgagor(s) and Guarantor(s) / secured Asset/s/Dues/Reserve Price/e-Auction Date & Time, EMD and Bid

Reserve Price Date and Name of the (Symbolic / Physical) & Nature of Property Name and Brief Description of the Property. Name of Borrowers Name of Outstanding Dues Owner of Contact No. (All Free Hold) Residential **Branch** as per Demand Name of Guarantors the Property **Bid Increase** Person No Notice P&M etc.) Mr.Devesh Raiendrasinh Baldevsinh Property House No.169 Sr. No.169 At Thikariya Faliya, Vadhwana, Tal. 01-04-2019 Rs.21.42.000/-BHALOD Raiendrasinh Physical Rs22,62,000 Jhagdia, Dist. Bharuch. Area 403.32 Sg.mtrs, Total Built-up Area 238.18 Possession Rs.2,15,000/ Brahmbhatt +Interest there 9099007405 & Residentia 1. Arjun Chhitabhai Parmar +Other Legal Rs.10.000/-2. Punam Abhesang Jaday Property Debashisa 05/05/2021 2. TANKARIA M/S SANJRI LAYER FARM Intekhabnadim RS No 575 Paiki, Plot No 16 To 20,22 To 27 & 29 to 46 Moje Physical Rs.66.66.000/ Rs.73.53.059.86 **BRANCH** Prop: Intekhabnadim Gangal Gangal Kahan, Tal. & Dist. Bharuch, Area 1911.89 sq.m Possession. Rs.6.67.000/-90990 07445 + Interest thereo Constructed Laye Hanif Hasan Sapa + Other & Legal Farm, Non Rs.10.000/-Agriculture Land Charges Land admeasuring 185.80 sq. mtrs. Situated at RS No. 126/1, Paiki, MSME Chauddhary Brothers Mr. Maksood Open Plot 04.01.2022 Rs.13,37,000/-R N Patil Ahmed Plot No 13 at Supermarket, Near Ansar Market, Opp Navjivan Hotel, Rs.2,48,20,468. Proprietor Maksood 8425900070 Rs.1.34.000 Inayullah Ahmed I Chaudhary Village Mouje Bhadkodra, Tal Ankleshwar Bharuch + interest Chaudhary applicable +

STATUTORY 15 DAYS SALE NOTICE UNDER SARFAESI ACT TO THE BORROWER/GUARANTOR/MORTGAGOR For detailed terms and conditions of sale, please refer to the link provided in

https://www.bankofbaroda.in/e-auction.htm, https://www.ibapi.in and www.mstcecommerce.com.

Place: Bank of Baroda, Bharuch. Date: 26.05.2023

(In the event of any discrepancy between the English version and any other language version of this auction notice, the English version shall prevail)

Other charges



ICIN: L24110MH1994PLC0761561

VIDHI SPECIALTY FOOD INGREDIENTS LIMITED

🕽 बैंक ऑफ़ बड़ौदा

Bank of Baroda

ि विजया D देना

Registered Office: E/27, Commerce Center 78, Tardeo Road, Mumbai-400034 Phone No.: 022-6140 6666; Fax No.: 022-23521980

Website: www.vidhifoodcolors.com: Email id: mitesh.manek@vidhifoodcolors.com

Extract of Audited Financial Results for the Quarter and financial year ended March 31, 2023

| | | | | | (muper | s III Lakiis) |
|--|--|---|--|--|---|--|
| | | Standalone | | | Consolidated | |
| Particulars | Quarter Ended March 31, 2023 (Audited) | Financial Year ended March 31, 2023 (Audited) | Quarter Ended March 31, 2022 (Audited) | Quarter Ended March 31, 2023 (Audited) | Financial Year ended March 31, 2023 (Audited) | Quarter Ended March 31, 2023 (Audited) |
| Total income from operations | 9,007.27 | 40,520.28 | 14,598.33 | 9,007.27 | 40,520.28 | 14,598.16 |
| Net Profit for the period | | | | | | |
| (before tax, Exceptional and/or Extraordinary items) | 1,111.35 | 4,995.45 | 1,826.03 | 1,103.51 | 4,979.95 | 1,820.05 |
| Net Profit for the period before tax | | | | | | |
| (after Exceptional and/or Extraordinary items) | 1,111.35 | 4,995.45 | 1,826.03 | 1,103.51 | 4,979.95 | 1,820.05 |
| Net Profit for the period after tax | | | | | | |
| (after Exceptional and/or Extraordinary items) | 886.23 | 3,785.50 | 1,384.47 | 878.39 | 3,770.00 | 1,378.49 |
| Total Comprehensive Income for the period | | | | | | |
| [Comprising Profit for the period (after tax) | | | | | | |
| and other Comprehensive Income (after Tax)] | 880.46 | 3,788.75 | 1,392.84 | 873.91 | 3,773.25 | 1,386.86 |
| Equity share capital | | | | | | |
| (Face Value of Equity Share Rs. 1/-Per Share) | 499.45 | 499.45 | 499.45 | 499.45 | 499.45 | 499.45 |
| Other Equity | | 24,639.25 | | | 24,572.69 | |
| Earnings Per Share (of Rs.1/- each) | | | | | | |
| (for continuing operations) | | | | | | |
| Basic: | 1.76 | 7.59 | 2.79 | 1.75 | 7.55 | 2.78 |
| Diluted: | 1.76 | 7.59 | 2.79 | 1.75 | 7.55 | 2.78 |

AHMEDABAD | SATURDAY, 27 MAY 2023 Business Standard

Note :

- The consolidated results for the guarter and year ended 31st March 2023 were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors in it's meeting held on 26th May 2023. The above results for the year ended 31st March 2023 have been audited by statutory auditors of the Company in terms of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosur Requirements) Regulations, 2015.
- This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescriber
- under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable. The Company operates in single business segment namely manufacturing and trading of food colors and chemicals. Hence, in separate disclosure as per "Ind AS-108" is required for the Operating segment.
- The Board of Directors at its meeting held on 26th May, 2023, has recommended Final Dividend of Rs. 0.40/- per equity share of Re
- 1/- each fully paid up, (i.e. 40%), for the Financial Year 2022-23 aggregating to Rs. 199.78 Lakhs. The figures of the guarters ended 31st March 2023 and 31st March 2022 are balancing figures between the audited figures in respec of the full financial year ended on 31st March 2023 and 31st March 2022 (Ind AS) respectively and the published year to date Ind AS figures upto third quarters ended on 31st December 2022 and 31st December 2021 respectively, which were subjected to a limite
- Previous period's figures have been regrouped / reclassified, wherever necessary to make them comparable with the current period For Vidhi Specialty Food Ingredients Limited / year.

Bipin M. Mane

Place : Mumbai

Housing Development Finance Corporation Ltd.

HDFC House, Nr. Mithakhali Six Road, Navrangpura,

NOTICE

DIN: 00416441

DEMAND

Chairman & Managing Directo

VIDHI

Ahmedabad. Phone: (079) 66307000 Under Section 13 (2) of the Securitisation And Reconstruction Of Financial Assets And Enforcement Of Security

Interest Act, 2002 (Act) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002.

Interest Act, 2002 (Act) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002.

Whereas the undersigned being the Authorised Officer of Housing Development Finance Corporation Ltd. (HDFC Limited) under Securitisation And Reconstruction Of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) listed hereunder, to pay the amounts mentioned in the respective Demand Notice/s, within 60 days from the date of the respective Notice/s, as per details given below. The undersigned have, caused these Notices to be pasted on the premises of the last known respective addresses of the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s). Copies of the said Notices are available with the undersigned, and the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) on may, if they so desire, collect the respective copy from the undersigned on any working day during normal office hours. In connection with the above, Notice is hereby given, once again, to the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) to pay to HDFC Limited, within 60 days from the date of publication of this Notice, the amounts indicated hereinbelow in their respective pay to HDFC Limited, within 60 days from the date of publication of this Notice, the amounts indicated hereinbelow in their respective

names, together with further interest @ 18% p.a. as detailed in the said Demand Notices from the respective dates mentioned below ir column (c) till the date of payment and / or realisation, read with the loan agreement and other documents/writings, if any, executed by the aid Borrower(s). As security for due repayment of the loan, the following Secured Asset(s) have been mortgaged to HDFC Limited by the

said Borrower (s) respectively.

Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is/are invited to the provisions of sub-section (8) of section 13 of th Act, in respect of time available to redeem the secured asset/s.

| Sr. No. | Name of Borrower(s)/ Guarantor(s)/Legal Heir(s) / Legal Representative(s) | Total Outstanding Dues | Date of Demand Notice | Description of Secured Asset(s)/ Immovable Property (ies) |
|------------|--|---|-----------------------------|--|
| (a) | (b) | (c) | (d) | (e) |
| 1 | MR. NATVARLAL BHIKHABHAI VANKAR (Borrower) Loan A/c No. 612559588 | Rs. 7,67,227/- as on 31-Mar., 2023* | 09 May, 2023 | HOUSE-75/A, S. NO. 402, GOKULDHAM-GANSHYAM NAGAF COLONY, VILLAGE-MADHAPAR, NAVAVAS, NR. INDRAVILLA SOCIETY, BHUJ-370001. |
| 2 | MR. NITINSINH JADAV (Borrower) MRS. GEETABEN NITINSINH JADAV (Co-Borrower) Loan A/c No. 643233086, 645138303 & 643233110 | Rs. 10,05,479/-, Rs. 18,592/- And Rs. 14,31,095/- Respectively as on 31-Mar., 2023* | 09 May, 2023 | FLAT-A-306, 3RD FLOOR, GANESH RESIDENCY, R. S. NO. 316, TPS-69 FP NO316, IOC ROAD, OPP. MAANSAROVAR TOWNSHIP, NR. SHYAMALGANGA APPT., TRAGAD, AHMEDABAD-382470. |
| 3 | MR. VICKY MARU (Borrower) MRS. SONAM VICKY MARU (Co-Borrower) Loan A/c No. 647004022, 647862569, 647862459 & 647004053 | Rs. 27,33,838/-, Rs. 25,264/-, Rs. 1,05,976 And Rs. 8,44,767/- Respectively as on 31-Mar., 2023* | 09 May, 2023 | FLAT-H/504, 5TH FLOOR, PANCHSHLOK RESIDENCY- BLOCK-H, PLOT FP-18, UNIT DTPS-69, S. NO. 251, 251/P, B/H. SATYAMEV HOSPITAL, NEW CHANDKHEDA, GANDHINAGAR-382424. |
| 4 | Wife/Son/Husband/Daughter of MR. GAJANAND HIRALAL JOSHI [Since Deceased] And other known and unknown Legal Heir(s), Legal Representative(s), Successors and Assigns of MR. GAJANAND HIRALAL JOSHI [Since Deceased] (Borrower) Loan A/c No. | Rs. 2,76,469 And Rs. 6,74,709/- Respectively as on 31-Mar., 2023* | 09 May, 2023 | FLAT NOA/304, 3RD FLOOR, SATKAR HOMES-BLOCK-A, R. S. 563/15 + 19, FP-45/4, 49/3, TP-58, BEHIND SHREERAM RESIDENCY, NAROL-ASLALI ROAD, NAROL, AHMEDABAD-382405. |

610812968 & 602511554 with further interest @ 18% p.a. as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and

If the said Borrowers shall fail to make payment to HDFC Limited as aforesaid, then HDFC Limited shall proceed against the abov Secured Asset(s) / Immovable Property (ies) under Section 13 (4) of the said Act and the applicable Rules entirely at the risk of the said Borrower(s)/Legal Heir(s)/Legal Representative(s) as to the costs and consequences.

The said Borrower (s) / Legal Heir(s) / Legal Representative(s) are prohibited under the said Act to transfer the aforesaid Secured Asse (s) / Immovable Property (ies), whether by way of sale, lease or otherwise without the prior written consent of HDFC Limited. Any person who contravenes or abets contravention of the provisions of the Act or Rules made thereunder shall be liable for imprisonment and/or penalty as provided under the Act

For Housing Development Finance Corporation Ltd

Date: 25-05-2023 Place : Ahmedabad

Authorised Officer

Regd. Office: Ramon House, H T Parekh Marg, 169, Backbay Reclamation, Churchgate, Mumbai- 400020. Corporate Identity Number: CIN: L70100MH1977PLC019916. E-mail: customer.service@hdfc.com, Website: www.hdfc

BARODA GUJARAT GRAMIN BANK

Increase Amount are mention below. For more details, Terms & Conditions of the Sale, please refer to website www.bankofbaroda.in/https://www.ibapi.in

Regional Office, Surat: 308, 3 rd Floor, City Center Complex, Nr. Yogichowk Circle, Varachha Road, Surat - 395 006. ${\bf Email: rosurat@barodagujaratrrb.co.in\ Website: www.bggb.in}$

E-Auction Notice (E-Auction Date: 30.06.2023)

-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules. 2002 Notice is hereby given to the public in general and in particular to the borrower(s) and Guarantor(s) that the below described immovable properties under the possession of Baroda Gujarat Gramin Bank will be sold on "As is Where is" and "As is What is" by e-Auction on 30.06.2023 to recover below mentioned secured loans, interest on loan, other expenses and charges. I auction will be conducted on websitehittps://sarfaesi.auctiontiger.net during 11:00 hrs to 13:00 hrs. [Auction of properties will be available on Auction Tiger App, too.]

Rs.10.000/-

| | | | 9 1 1 | 0 117 1 | | |
|----|-----------------|--|--|---|-----------------|------------|
| S | Branch Name & | | Total Demand due as per 13(2) | Description of Immovable property | Reserve Price | Status of |
| No | . Mobile Number | and Guarantor (s) | - Demand notice amount | | EMD | Possession |
| 1 | Bharuch | Mrs. Sushila Balraj | Rs. 21,21,852.00 + interest + charges as per | All the pieces & parcels of property bearing R.S.290 commercial plot No.801/1 admeasuring 931.25 sq.mts. on which flat No.S/2, second floor, super build up area 78.50 sq.mtrs. situated in Lenox | Rs. 14,13,000/- | Physical |
| Ľ | (M-9099007002) | Kaushik | 13(2) notice Dtd.20-07-2021 | Cooperative Housing Society Limited, Village: Bhadkodra, Ta: Ankleshwar, Dist: Bharuch in the name of Mrs. Sushila Balraj Kaushik. | Rs. 1,41,300/- | i iiyoloui |
| 2 | Bharuch | Mr. Hiteshbhai Ramjibhai | Rs. 23,38,885.69 + interest + charges as per | All the pieces & parcels of property bearing Revenue Survey No.98 paikee Flat No.B-404, Four Floor, B-Building, in "Crystal Avenue" Admeasuring Area 94.30 Sq.Mt. undivided share of land 28.29 Sq.mt. | Rs. 15,53,000/- | Physical |
| 1 | (M-9099007002) | Parmar | 13(2) notice Dtd.08.06.2022. | situated in sim of Gadkol, Ta-Ankleshwar, Dist-Bharuch, in the name of Mr. Hitesh Ramjibhai Parmar. | Rs. 1,55,300/- | 1 Hyoloui |
| | | Mr. Rahulbhai Madhukarbhai | Rs. 11,47,053.04 +interest + charges as per | All the pieces & parcels of property being Plot no C-32 paiki north side portion, admeasuring 33.58 Sq. Mtrs. Land area and 45.215 Sq. Mtrs. Construction area, Block No. 54/A/32,"Shreeji Darshan" | Rs. 13,00,000/- | Physical |
| Ľ | (M-9099007013) | More | 13(2) notice Dtd. 09.09.2022 | Residency, situated at Vankvel, At &po. Vankvel, Ta. Songadh, Dist. Tapi, standing in the name of Mr. Rahul Madhukar More. | Rs. 1,30,000/- | 1 Hysical |
| Γ. | Jahangirpura | Mrs. Payal Varunbhai Diyora & | Rs. 22,73,908.00 +interest + charges as per | All the pieces and parcel of the immovable property Flat no 406 admeasuring 54.85 Sq. Mtrs. on the 4th floor of WELCOME TOWER of Welcome Tower Co-Operative Housing Society Ltd. along with undivided proportionate share in the land under the said building constructed on the land of Sub - Plot Nos. 2,3 and 6 of final plot No 25, T.P. Scheme No. 14 (Rander), Revenue Survey No. 237 of Moje | Rs. 16,66,000/- | Dhusiasi |
| 4 | (M-7574803201) | Mr. Varunbhai Narendrabhai Diyora | 13(2) notice Dtd. 02.02.2020 | Rander, City Surat Taluka Choryasi, District Surat. The above said property belongs to Mrs. Payal Varunbhai Diyora. | Rs. 1,66,600/- | Physical |
| | Kathor | Mr. Ghanshyambhai Popatbhai | Rs. 18,58,489.00 +interest + charges as per | All the piece and parcels of immovable property bearing Plot No.23 admeasuring 60.23 sq.mtrs (Built up area) together with undivided proportionate share in road and cop at "Shiv Darshan Residency" | Rs. 14,27,000/- | B1 |
| 5 | (M-9099997685) | Dobariya & Mrs. Kailashben Ghanshyambhai Dobariya | 13(2) notice Dtd. 25.11.2022 | situated on the land bearing sub plot No.2 admeasuring 33818.25 sq.mtrs of re-survey New Block No.14(Old Block No.13 of Rev. S. Nos. 4+314+315,310,311,312,313) admeasuring 74445.00 sq.mtrs situated at Moje: Shekhpur, Sub district Kamrej, District: Surat in the names of (1) Kailasben Ghanshyambhai Dobariya, (2) Mrs. Ghanshyambhai Popatbhai Dobariya. | Rs. 1,42,700- | Physical |
| Γ | Kathor | Mr. Aniruddhsinh Prabhatsinh | Rs. 29,27,138 + interest + charges as per | All the piece & parcel of the immovable property bearing Flat No.104 admeasuring 1241.00 sq.ft. equivalent to 115.33 sq.mtrs. on 2nd Floor together with undivided proportionate share in underneath land | Rs. 17,94,000/- | Discolard |
| | (M-9099997685) | Gohil & Mrs.Varshaba Aniruddhsinh Gohil | 13(2) notice Dtd. 31.12.2022 | admeasuring 34.60 sq.mtrs "D" wing out of "C" & "D" wing of Dada Bhagwan Complex constructed on the land bearing as per KJP New block No.111/Part-2 of Block No.111 part of village Navagam Sub District Taluka Kamrej, District Surat owned by Mrs. Varshaba Aniruddhsinh Gohil. | Rs. 1,79,400/- | Physical |
| Γ, | Karanj | Mr. Dhansukhbhai | Rs. 1,31,745.90 + interest + charges as per | All the piece & parcel of N.A.land known by name Subham residency Block No. 148 paiki plot No. E-112, area of 83.64 sq.mt. of village Kim-Kathodara, Ta. Olpad, Dist. Surat, belonging to Mr. Dhansukhbhai | Rs.10,98,000/- | Physical |
| Ľ | (M-9099007156) | Zinabhai Patel | 13(2) notice Dtd. 06.02.2023 | Zinabhai Patel | Rs. 1,09,800/- | Filysical |
| | Variav | Mrs. Kajal Laljibhai Gajera & | Rs. 17,09,296.00 +interest + charges as per | All th pieces and parcel of the immovable property E/2, Flat No.201, 2nd floor, building No.E/2, Star manorath, Survey No.48 (Kholwad), F.P.No.140, Pasodara Char Rasta, At & Po. Kholwad, Tal. Kamrej, | Rs.13,73,760/- | Symbolic |
| 8 | (M-7574803237) | Mr. Laljibhai Pravinbhai Gajera | 13(2) notice Dtd. 02.01.2020 | Dist. Surat belonging to Mrs. Kajal Laljibhai Gajera & Mr. Laljibhai Pravinbhai Gajera. | Rs. 1,37,376/- | Symbolic |

For details terms and conditions of auction please refer the link provided on bank's website https://www.bggb.in/e_auction.php

STATUTORY 30 DAYS SALE NOTICE UNDER SARFAESI ACT, 2002 Borrowers/ Guarantors are hereby informed by this notice to deposit Demand amount with interest and other expenses before last date of auction, failing which, properties will be auctioned sale and if any amount remain due after auction/sale, will be recovered with interest and other expenses

Place: Surat - Date: 27.05.2023 Authorized Officer - Baroda Gujarat Gramin Bank

બ્રીજ છેલ્લા કેટલાક સમચથી બિસ્માર બનવા ઉપરાંત છાશવારે સર્જાતી ટાફિક સમસ્થા અને અકસ્માતોને નિવારવા

ભાલેજ બ્રીજ પરથી ટ્રાફિક 👢 હળવો કરવા

લ્સિન ફાટક પાસેના નાળામાંથી ટ્રાફિક શરૂ કરવા લોકમાંગણી

બ્રીજની મજબૂતી માટે રૂ. ૩ કરોડની ફાળવણી કરવામાં આવતા નવા ફ્લાચઓવર કે બ્રીજ પહોળો કરવાની માગ હથેળીમાં ચાંદ બની

સાડા ત્રણ દાયકા પૂર્વે આણે સામરખા ચોકડીને જોડતો ભાલેજ બીજ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર બનવા ઉપરાંત છાશવારે સજોતી ટાકિક સમસ્ય અને અકસ્માત દુર્ધેટનાના પગલે બીજ પહોળો કરવા કે નવા કલાયઓવરની માગ ઉઠવા પામી રહી છે. જે વતેમાનમા હથેળીમાં યાદ બનવા પામી રહી હોય તેના વિકલ્પ સ્વરૂપે ભાલેજ બીજના ભારવહન હળવા કરવા વર્ષો પૂર્વ આવંદ સામરખા ચોકડીના . આવાગમન માટે સાકાર કરવામાં આવ્યો આવેલ પોલ્સન કાટક



તેવી માગ ઉઠવા પામી છે.પ્રાપ્ત વિગત અનુસાર શહેર અને સામરખા ચોકડીને આવાગમનથી જોડવા સાડા ત્રણ દાયકા પૂર્વ

કુરી કાર્યોન્વિન્ત કરવામાં આવે. આણંદ જીલ્લો બનતાં શહેરમાં વાહનોના આવાગમનમાં વધારો થતાં ભાલેજ બ્રીજ પર છાશવારે ટ્રાફિક સમસ્યા તથા અકસ્માત દુર્ઘટનાના બનાવ બનતાં બ્રીજને પહોળો કરવા કે ગજીકના ગરનાળાને તુલસી ભાવેજ શ્રીજ સાકાર કરવામાં બનતાં બ્રીજને પહોળો કરવા કે ગરનાળાની માકક નવીનીકરણ આવ્યો હતો. પરંતુ બાદમાં નવાકલાયઓવર બનાવવાની

સરકાર દ્વારા બીજ બિસ્માર બનતાં તેની મજબૂતી માટે રૂ. ૩ કરોડની કાળવણી કરવામાં આવતા નવા કલાયઓવર કે બ્રીજ પહોળો કરવાની માગ હથેળીમાં ચાંદ બનવા પામતાં ભાલેજ બ્રીજ પરના ભારણ ધટાડવા વર્ષો પૂર્વ આણંદથી સામરખા ચોકડી તરફ જવા પોલ્સન ફાટક નજીક ગરનાળુ બનાવવામાં આવ્યું હતું. જે ભાલેજ બીજ બન્યાબાદ ગરનાળાની ઉપયોગીતા નહીવત બનતાં પુરાણ થવા પામતાં વર્ષ પૂર્વ જે રીતે તુલસી ગરનાળાને યૂવ જ રાત તુવસા ગરનાગાન પહોળું કરવામાં આવ્યું તે રીતે માણેજા સ્કૂલ પોલ્સન ફાટક માગે પરના ગરેનાળાનું નવીનીકરણ

માર્ગ ઉઠવા પામી હતી. પરંતુ ભાલેજ બ્રીજ માટે સાંસદ, ધારાસભ્યની રજૂઆત કારગત નિવડશે?

આણંદ સામરખાચોકડીને જોડતો ભાલેજબ્રીજ બિસ્માર બનવા ઉપરાંત છારાવારે ટ્રાફિક સમસ્યા તથા અકસ્માત દુધેટના સજાતી હોય તેને પહોળો કરવા કે નવા કલાયઓવર બનાવવાની માગ ઉઠતાં ઉલ્લેખનીય છે કે પૂર્વ પાલીકા પ્રમુખ કત્તીભાઇ ચાવડાએ એન. એસ પટેલ સકેલથી સામર ખા ચોકડી નવા કલાયઓવર સાથે કોરલેન ની સરકારમાં ચારવર્ષ પૂર્વ રજુઆત કરી હતી. બાદમાં તાજેતરમાં શહેર ભાજપ લધુમતી મોરચાના ઉપપ્રમુખ અદરીક નારિયેળવાળાએ ધારાસભ્ય ધારેશ પટેલને રજૂઆત કરી હતી. જેના પગલે ધારાસભ્ય ધોગેશ પટેલ તથા સાંસદ મિતેપ પટેલે રાજ્યથી લઇ કેન્દ્ર સુધી રજૂઆત કરી હોવા છતાં બિસ્માર ભાલેજ બ્રીજની મજબૃતાઇ માટે સરકારે રૂપિયાત્રણ કરોડની કાળવણી કરી હોય બંને નેતાની રજૂઓત કારગત નિવડશે કે કેમ તેવાસવાલ ઉઠવા પામ્યા છે.

કરી કાર્યોન્વિન્ત કરવા માગ ઉઠવા જો આ ગરનાળાને કાર્યોન્વિન્ત પામી હોવાનું જણાવા મળેલ છે. કરવામાં આવે તો ભાલેજ સ્થાનિકો ના જણાવ્યા પ્રમાણે બીજ પર ૪૦% જેટલું વાહન

કાંસ પર પુરાણ કરી નજીકની જમીનને બહુમુલ્ય કરવાના સ્થાનિક નેતાઓ સાથે સાંઠગાંઠથી ખેલ રચાયો..!

આણંદ પાલિકા દારા ચાર વર્ષ પૂર્વ નવી ડી.પી.તથા ચૌદ જેટલી ટી.પી.ની માગ કરતી દરાખાસ્ત અવકુદામાં કરવામાં આવ્યા બાદ અવકુદા દ્વારા સરકારમાં દરખાસ્ત કરતાં આજે ચાર વર્ષે પણ વિભાગ દ્વારા દર ત્રણ માસે રિમાઇન્ડર કરવા છતાં તેની પાછળ પૂર્વ વિસ્તારમાં રાજકીય ઓય હેઠળ કે મલાઇ વહીવટથી સાકાર દબાણ બોંપકામ પર અસરના કારણે સરકાર દ્વારા ઠાગાઠિયા કરવામાં આવી રહ્યા હોવાના સંદેહ સાથે હવે પૂર્વ વિસ્તારમાં આવેલ જમીનને બહુમૂલ્ય સ્થાનિક નેતાઓ સાથે વહીવટી સાંઠગાંઠા રચી પસાર થતાં કાંસ પર પુરાલ કરવાના ખેલ રચવામાં આવી રહ્યા હોવાની ચર્ચા વેગ પકડતાં તંત્ર દ્વારા પ્રીમોન્સૂન કામગીરી હેઠળ કાંસ સકાઈ હાથ ધરવામાં આવે તો સદર વિસ્તારમાં થતા કાંસ પુરાલનો ચોકાવનારો ધટસ્કોટ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

આવાગમન ભારણ ધટવા પામશે. ઉકેલ માટે પ્રયાસ હાથ ધરવામાં સ્થાનિક નેતાગીરી નળળી હોય આવે તેવી રજૂઆત કરવામાં જીલ્લા વહીવટી તંત્ર દારા યોગ્ય આવી હોવાનું જાલવા મળેલ છે.

મેડિકલ સ્ટોર્સમાં સીસીટીવી ફરજિયાત લગાવવાના આદેશનું ઉલ્લંઘન : સીસીટીવી લગાવ્યા ન હોય તેવા જહેર સંસ્થાઓની દિવાલ પર સત્તા પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર હાથ ધરતા વિવાદ

સંચાલકો વિરુદ્ધ ફાર્મા.એસો. ની કલેકટરને રજૂઆત

આણદ,તા.૨૬ મેડિકલ સ્ટોર્સમાં ઉપયોગમાં લેવામાં નશાના આવતી ઉવવાગમાં જેવામાં ઓવતા દવાઓનું વેચાલ અટકાવવાના ઉદેશ્યથી રાષ્ટ્રીય બાળ અધિકાર કમિશન દ્વારા દરેક મેડિકલ સ્ટોર્સમાં સીસીટીની કેમેરા કરજિયાત લગાવવા આદેશ કરેલ જેનો આલંદ જિલ્લામાં અમલ કરાવવાના તેતથી આણંદ જિલ્લાના કલેકટર દારા કેબ્રુઆરી મહિનામાં એક માસની મુદતમાં આવંદ જિલ્લાના દરેક મેડિકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા કરજિયાત લગાવવા આદેશ કર્યો હતો. પરંત આવંદ જિલ્લામાં સિત્તેર ટકા કરતાં વધુ મેડિકલ સ્ટોર્સ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ ૧૯૪૦નું ઉલ્લંઘન કરી કામાંસિસ્ટની ઉલ્લંઘન કરી ગેરહાજરીમાં જ સિડયુલ ૐ અને ઠ દવાનું ગેરકાવદેસર રીતે વેચાણ કરતાં હોઈ સીસીટીવી કેમેરા



લગાવવાથી તમામ વાથી તમામ ગેરરીતિઓ આવે એમ હોઈ હજી સુધી સીસીટીવી કેમેરા લગાવેલ નથી.વર્ષોથી કાર્માસિસ્ટનું માત્ર લાયસન્સ ભાડે લાવી ગલીએ ગલીએ દવાની ખુલેલી હાટડીઓને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદના અધિકારીઓનું ધીઠબળ હોઈ પોતાનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એ માટે ખોરાક અને ઔપષ અધિકારીઓએ સીસીટીવી કેમેરા આદેશનો અમલ કરાવવા કોઈ ਕਰਵੀ ਕੀਬੀ ਜਮੀ ਰਜ਼ਸ਼ ਬਾਲਾਵਾਵੀ

રોકવા માટે સીસીટીવી લગાવેલા હોય એવા મેડિકલ સ્ટોર્સ ન હાપ એપા માડકળ સ્ટાસ સીલ કરવા અને સંચાલકો વિરુદ્ધ કોજદારી ચુનો દાખલ કરવાની જવાબદારી સ્પેશ્યલ ઓપરેશન જવાબદારા સ્વસ્થલ આવરશ ગ્રૂપને સોપવાની માંગ સાથે ગુજરાત કાર્માસિસ્ટ એસોસિએશન (થ્છ) દ્રારા કલેક્ટરને રજઆત કરવામાં આવી હતી. ગુજરાત કાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીયે જશાવ્યું હતું કે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ ૧૯૪૦ મુજબ ફાર્માસિસ્ટની હાજરીમાં જ દવાનું વેચાણ થવું જોઈએ પરંતુ ડ્રગ વિભાગની રહેમ નજર હેઠળ આણંદ જિલ્લામાં સિત્તેર ટેકા કરતાં પણ વયુ મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના मात्र वायसन्स ઉपर गावे छे. अने क्रामॉसिस्ट अन्य જગ्याओ नोक्टी કરતાં હોય તમામ ગેરકાયદે પ્રવત્તિ

સામે આખ આડા કાન કરવા તહેવાર પર વહીવટી ખેલ મેડીકલ સ્ટોસે ષારકો ડુગ ઇન્સ્પેક્ટર સાથે રચતા હોય છે. સાથે સાથે નવા મેડીકલ સ્ટોર્સના લાયસન્સ માટે પણ તગડા વહીવટ ના ચુકવણા કરવા માગ કરવામાં આવતી હોય પછી નશાના સેવનના બેરોકટોક વેપલા કરવામાં આવતા હોય છે. જેના પગલે આણંદના યુવાયનને બચાવવા સીસીટીવી કેમેરાના આદેશનું પાલન કરાવવાની જવાબદારી ડ્રગ વિભાગને સોપવામાં આવશે તો લાંચિયા અધિકારીઓ તેમાં પણ મલાઇ વહીવટના એલ આચરશે તેના કારણે મેડીકલ સ્ટોસે ખાતે ત્વાર કારણ વહાડવ સ્ટાસ વાત સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે કે કેમ?ની ચકાસલી જવાબદારી ਪੰਤੀਸ਼ ਰਿਘਾਸ਼ਜੇ ਸੰਪਿਧਾਜ બાદેશના અસરકારક પાલન થશે તેવી માગ કરવામાં આવી હતી.

અગાઉ તળાવ બ્યુટીફ્રીકેશન બાદ રેલીગ પર કાયમી પક્ષ ચિન્હ મૂકયા



બાગામી લોકસભા જંગ આડે અગીવાર માસનો સમયગાળો બાકી હોય રાજકીય પક્ષો દ્વારા જીત માટે કમરકસતા સત્તા પત્ત હારા કોર્ટના હુકમ છતાં તેની અવગણના કરી અધેસરકારી તથા જાહેર સંસ્થાઓની દિવાલ પર પક્ષ પ્રચાર પ્રસાર હાય ધરવામાં આવતા વિવાદ વકરવા પામ્યાનું જાણવા મળેલ છે. અત્રે

નોંધનીય છેકે પાંચ વર્ષ પૂર્વ શહેરના તળાવના બ્યુટીફીકેશનની કામગીરી સાથે તળાવ કરતે રેલીગ પર પશ ચિન્હ મૂકવામાં આવ્યા હતા. તેમ છતાં સ્થાનિક ચૂંટણીતંત્ર હતા. તેમ છતા સ્વાન્ડ યુદ્ધાતત્ર માજા તેમાં અપક્ષાત્ર ક્ષારા આંખ આડા કાવ કે જેની જાહેર સંસ્થાઓની સરકાર એની દરકાર કરતાં તંત્ર પક્ષ પ્રચાર પ્રસાર હ પર અંગુલીનિર્દેશ થવા પામી આવતાં વકરેલા વિ રહ્યાનું જીણવા મળેલ છે. ત્યારે પગલાં લેશે?કે પછી.

કુલટેન્ડર-૦૧

ન્ડર આઈ.ડી. ન્યલ્ય ૨૩૮

તાજેતરમાં અપેસરકારી તેમજ જાહેર સંસ્થાઓની દિવાલ પર પક્ષ પ્રચાર પ્રસાર હાથ ધરવામાં આવતાં વકરેલા વિવાદ પર તંત્ર 1 જાલવા વન્ન વોટર એન્ડ સેવીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન. અધીનગર

પ્રાદેશિક કમિશનર.કચેરી દ્વારા તપાસ હાથ ધરાઈ બાગબગીચાની જાળવણીના જાહેર ટેન્ડર શાસકીય નેતાઓના કોન્ટ્રાકટ લેવા ભાગબટાઇના ખેલ

પખવાડિયા પૂર્વે આશંદ નગર સેવા સદન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા બાગબગીચાની જાળવણી માટેની ટેન્ડર પ્રક્રિયા હાય ધરી હતી. પરંતુ પ્રારંભથી જ કોન્ટ્રાક્ટ મેળવવા ભાગબટાઇના ખેલ રચાય તેવી આશંકા દુઢ બનવા પામી હોય તેમ ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાના બદલે ઓફલાઇન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત નેતાઓએ કોન્ટાક્ટ મેળવવા ભાગબટાઇના ખેલ રચ્યા તોય પ્રાદેશિક કમીક્ષર દ્વારા તટસ્થ તપાસ હાથ પરવામાં આવે તો નેતાઓના પગ નીચે રેલા આવવાની શકપતા પ્રવતવા પામી હોવાનું જણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા દશકથી આણંદ પાલીકા શાસક્રીય નેતાઓ માટે બોડીબામણીનું ખેતર બનવા પામ્યુ હોય લઉ રીગણ બે ચાર લેને બઇ દશબારના રચાતા ખેલ વર્તમાનમા પણ પંચાવત રહેવા પામ્યા હોય તેમ પખવાડિયા પર્વ પાલીકા કારા શતેરના વિવિધ વિસ્તારમાં બાગબગીચાની જાળવણી માટેના ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ પ્રથમથી જ વહીવટી સાંઠગાંઠના ખેલ

કે અન્ય આર્થિક ઉપાજેનના ચોકા રચવામાં આવ્યા હોય તેમ આશરે પાત્રીસ લાખન ખર્ચે બાગબગીચાની જાળવણીના ઓનલાઇન હાથ ધરવાના બદલે રકમના વર્ગીકરણના ખેલ રચી ઓકલાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા સાથે બહારના કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર કોપી લેવા જવા સમયે વિભાગ કારા નકારવામાં આવતાં તે સમયથી શરૂ યયેલ વિવાદ બાદ સમગ્ર પ્રક્રિયામાં કક્ત મળતીયાઓને જ કોન્ટ્રાક્ટ આપવાના સેટિંગ કરવામાં આવ્યા હોય પાલીકા સુત્રના જણાવ્યા પ્રમાણે બાગ્બગીયાની ટેન્ડર પ્રક્રિયા નામ પુરતી જ હોય તેમ ચાર જેટલા નેતાએ નામ પૂરતો જ કાય તમ ચાર જુટલા નતાઓ હારા મળતીયાઓ માટેના કોન્ટ્રાક્ટ મેળવવા ભાગબટાઇના ખેલ સ્ટ્ર્યા હોવાનું જીલા મળેલ છે. વધુમાં બાગબગીચાની જાળવણીના કામ સાંઠગંઠથી સોપાતા હોવાના કારણે માત્ર કાગળ પર કે પાલિકાના જ કર્મચારી દારા જાળવાની ખેલ રચી મલાઇ ઓહીવા કરવામ આવતું હોવાનું જાણવા મળતા જો આ મુદે પ્રાદેશિક કમિશ્રર વડોદરા દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો ધણાના પગ નીચે રેલા આવવાની શક્યતા પણ પ્રવતેવા પામી છે

આણંદ રેલવે સલાહકાર સમિતિના દશ સભ્યોની થયેલી નિમણું કશોભાના ગાંઠિયા બની

આશંદ,તા.૨૬

સત્તા મળતા જ રાજકીય પક્ષના નેતાઓ ાના મળતીયાઓની વિવિધ વિભાગોમાં સભ્ય કે અન્ય પદ પર રાજકીય બલામણથી નિમણુંક કરવામાં આવતી હોય છે. પરંતુ કેટલીક વખત બાલાદવલાને સાચવવા કરવામાં આવતી નિમણુંક માત્ર શોભાના ગોંઠિયા બનતી હોય આણંદ રેલવે વિભાગમાં દશ જેટલા નેતાઓની જીલ્લામાંથી સલાહકાર સમીતીમા પસંદગી તો કરવામાં આવી પરંતુ રેલ્વે સ્ટેશન પર યોજાતી બેઠકમાં કક્ત આગળી ઉચી કરતાં હોય સભ્યોની કરાતી રાજકીય નિમૃદ્ધુંક પર્ સવાલ ઉઠવા પામી રહ્યા છે. આસંદ રેલ્વે ખાતે રાજકીય નેતાઓની ભલામણથી જીલ્લાના વિવિષ વિસ્તારના પક્ષની વિચારયારા કરનારાની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ કમનસીબે આલંદ સ્ટેશનના બ્યુટીકીકેશનની વાત હોય વિવિધ ટ્રેનના સ્ટોપેજ,ફ્ટબીજ, ગરનાળ, અંગ્રેજોના જમાનાનું બિસ્માર રેલ્વે પોલીસ સ્ટેશન સહિતના સળગતા પ્રશ્નો ના ઉકેલ માટે સલાહકાર સમીતી સભ્યો દ્વારા કદી રજૂઆત કરવામાં ન આવી હોવા ઉપરાંત માત્ર આગળી ઉચી કરતાં હોય આર્થાદના રેલ્વેના પ્રશ્નો થયાવત રહેવા પામતી હોય તો વહાલાદવલાની રાજકીય નેતાઓની ભલામણ થી નિમલુંક પસંદગી કેમ?જેવા સવાલ ઉઠવા પામી રહ્યા છે

ગુગલના સીઈઓની ચેતવણી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લોકોને નુકસાન પહોંચાડી શકે છે

વોશિંગ્ટન, તા. ર ક ગુગલના પૂર્વ સીઈઓ એરિક સ્મિટે આર્ટિકિશિયલ ઈન્ટેલિજન્સને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, આર્ટિકિશિયલ ઈન્ટેલિજન્સ નજીકના બવિષ્યમાં લોકોને નુકસાન પહોંચાડી શકે છે. સ્મિટે ઝડપથી વિકસતી ટેક્નોલોજથી સંબવિત "અસ્તિત્વીય જોખમો" વિશે યેતવળી આપી હતી અને એઆઈને વનવણા આપા હતા અને અન્ભાઇન નિયંત્રિત કરવા માટેના નિયમો ધડવા અંગે પણ વાત કરી હતી. એઆઈ પર પિતા વ્યક્ત કરતા ગુગલના પૂર્વ સીઈઓએ કહ્યું હતું કે, લોકોને ગેંભીર નુકશાન પહોંચાડવાથી લઈને માણસને મૃત્યુ સુધી આ એઆઈ લઈ જઈ શકે છે.ખુષવાર વોલ સ્ટ્રીટ જર્નલની સીઈઓ ક્રાઉન્સિલની બેઠક દરમિયાન બોલતા તેમણે ટિપ્પણી કરી હતી કે, આજે એટલી સમસ્યા નથી પણ નજીકના ભવિષ્યમાં ઝીરો ડે એક્સપ્લોટ, સાઈબર સમસ્યા અને નવી બાયોલોજીકલ બીમારીઓનો સામનો કરવો પડશે. આ ટેકનોલોજીવી ભવિષ્યમાં

કરવા પડશ. આ ટક્યાલાજવા ભાવવ્યમા થનારી મુશ્કેલીઓ એંગે ચેતવણી આપી અને એઆઈને રેગ્યુલેટ કરવા નિયમો લાવવા

અંગે પણ વાત કરી હતી. સ્મિટે ૨૦૦૧

થી 2011 સુધી ગુગલ સીઈઓ અને ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી આલ્કાબેટના એક્ટિક્ક્યુટિવ ચેરમેન તરીકે લેવા આપી હતી. ગુગલના પૂર્વ સીઈઓ ઉપરાંત હતુંના પ્રધાનની સ્ત્રેય સુને પણ હાલમાં ઓપન એઆઈ. ગુગલ ડીમાઈન્ડ અને એન્સોપિટના માલિકો સાથે મુશકાલ કરી હતી. આ દંપનીઓએ એમના નિવેદનમાં કહ્યું હતું કે, ટ્રાન્સકોર્યસન દેવનોલોજને કહ્યું હતું કે, ટ્રાન્સકોર્યસન દેવનોલોજને સુધ્યે લતા કરી હતી. આ દંપનીઓએ એમના નિવેદનમાં કહ્યું હતું કે, ટ્રાન્સકોર્યસન દેવનોલોજને સુધ્યે લતા નુ કરાયે લતા નુ કરાયે લતા નુ કરાયે લતા તેને તેનો સાથે મળીને કામ કરશે.

નામ બદલેલ છે

લગ્ન પેલાનું નામ રીટાબેન હતું લગ્ન પછી નું નામ પ્રિયા બેન વિનોદકુમાર બેલારામાની રાખવામાં આવીયુ છે. તમામ દસતાવેજમાં પ્રિયા બેન વિનોદ સ્ત્રામાની સ્ત્રામાની રાખવામાં આવીયુ છે.

મોરવા (હ), શહેરા, કાલોલ, હાલોલ, ઘોર્યળા અને જાંબધોડા તાલકાનાં નલ ત્રાવાના (૦), તારાવા, કારાવાના હાલાવા, વ્યાવના ખેત હતું માંક તાલુકાના કોંગ્રેક્ટ ને કેટ કર્ફટ થઈ બંધ મે જેલ ક્રાંધ કેમ સિવાય અગાઉ પુણં વેલેલ યોજનામાં લીકેજ / તુટ ફૂટ થઈ બંધ પડેલ હોય તેવા ગામો ને પુન: ક્રાયાંન્ચિત કરવા માટે થતી કામગીદી માટે કુલ-૦૧ ક્રામ માટે ઈ-૧ અને તેની ઉપરના રજીસ્ટ્રેશન પરવવના ઇજારદરો પાસે અંદાજન કિંમત રૂ ૧ ૫૭૯ ૨૨૧.૪૧ લાખ માટે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવે છે. ટેન્ડરો ઓનલાઈન ભરવાની છેલ્લી તા,૦૫-૦૬-૨૦૨ કર્ના રોજ ૧૮:૦૦ કલાક સુધી અને ફ્રીઝીકલ ડોક્યુમેન્ટ સ્વીકારવાની અંતિમતારીખતા,૦૨-૦૨ ૨૦૨૩ ઓફીસ સમય દરમ્યાન રહેશે, ફીઝીકલ ડોક્યુમેન્ટ રજસ્ટર એ.ડી અથવા સ્પીડ પોસ્ટથી સાદર કરવાનાં રહેશે. ટેન્ડર અન્વયે વધુ વિગતો વેબ સાઈટ થતા નકશાન માટે તેઓ સાથે www.nprocure.com પર ઉપલબ્ધ છે. ટેન્ડર અન્વયે જરૂરી કેરકાર

નોંધઃ- કોઈપણ ટેન્ડર સ્વીકારવુ કે ટેન્ડર રદ કરવાની સત્તા યુનિટ મેનેજસ્થ્રી, જીલ્લા જળ અને સ્વચ્છતા એકમા, પંચમહાલની રહેશે.

જીલ્લા જળ અને સ્વચ્છતા એકમ, વાસ્મો – પંચમહાલ જલ જીવન મિશન ''નલ સે જલ''

જાહેર નિવિદાનં.૦૪, સન ૨૦૨૩-૨૪

યનિટ મેનેજરહી, જલ્લા જળ અને સ્વચ્છના એકમ, ટાઈપ પ/૧, BSNI

શુપ્તટ મયુકરક્ષા, જીલ્લા જેમ અને સ્વચ્છતા અક્રમ, ટાઇપ પાય, છાંગા ક્વાર્ટસ, સિવિલ લાઈન્સ રોડ, ગોપરા∙ ૩૮૯૦૦૧, મોબાઈલ નં. ૯૯૭૮૪૪૨૯૭૦, વાસ્મો -પંચમતાલ દ્વારા પંચમતાલ જીલ્લાનાં ગોપરા

ગ્રામ્ય કશાની પાણી પુરવઠા યોજનાઓ માટે રાજ્યકશાએ દિવસ રાત કંટ્રોલ રૂગ કાર્યરત છે. જયા ટોલ કી નંબર — ૧૯૧૬ ઉપર પાણી સબંધિત કરિયાદ / સુચને માટે સંવર્ક કરી શકાય

(માહિતી/ગોધરા/૧૮૪/૨૩)



Chemcon Speciality Chemicals Limited (AN ISO 9001:2015 and ISO 14001:2015 Certified Company) Regic Office: Blook Rumber 258, Weiplane Kungan Stand, Meripane Villaga, Talinka Eanil, Vacidaria 3917 (LICENTIA) Regic Office: Blook Rumber 258, Weiplane Kungan Stand, Meripane Villaga, Talinka Eanil, Vacidaria 3917 (LICENTIA) Regic Office: Blook Rumber 258, Weiplane Kungan Stand, Meripane Villaga, Talinka Eanil, Vacidaria 3917 Regic Office: Blook Rumber 258, Weiplane Kungan Stand Regic Office: Blook Rumb

સુધારાની વિગતો માત્ર ઓનલાઈન જોઈ શકાશે

STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2023 Total income from operations
 Net Profit(Loss) for the period
 (before Tax, Exceptional and/or Extraordinary items
 Net Profit(Loss) for the period before tax. 5.195.84 1,420.72 8.092.97 9.184.34 1.522.33 2.840.08 7,415.14 1,522.33 2.840.08 7,415,14 1,420.72 8 399 5 Net Profit Cost for the period before tax infer Exceptional and/or Extraordinary Bensyl.

Net Profit Cost for the period after tax infer Exceptional and/or Extraordinary Bensyl.

Net Profit Comprehensive Income for the period Comprehensive Income for the period Comprehensive Income (after tax).

Total Comprehensive Income (after tax).

I Equity Strain Capital.

II Emily Strain Capital.

III Other Equity Strain (after the period Infer tax).

III Emily Period (after the period Infer tax). 1.047.01 1,135.86 2,128.84 5,511.01 6.275.68 1.035.96 1,130.19 2.096.28 5.482.92 6.243.50 3.663.07 3.663.07 3.663.07 3.10 5.81 2.86 6 Marris 35, 2022 and 5

(Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Company's website at www.cocpl.com and the Stock Exchange's Website at www.besindia.com

By order of the Board For Chemcon Specialit mcon Speciality Chemicals Limit

Kamalkumar Rajendra Aggarwal Chairman & Managing Director DIN: 00139199

| SAMBHAAV | MEDIA | LIMITED |
|-------------------------|---------|---------|
| (CIN: 1821205.11880F) C | 0140949 | |

EXTRACTS OF STANDALONE AND CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR FI

| | | | | Standalpne | | Cessilitated | | | | | |
|----|--|---------------|------------|------------|------------|--------------|--------------|------------|------------|------------|-----------|
| | | Quarter Endet | | | Tear Ended | | Queter Ended | | | Tour Ended | |
| SK | Particulan | 31-03-2023 | 31-12-2022 | 31-03-2022 | 31-03-2023 | 31-03-2022 | 31-63-2023 | 31-12-2022 | 31-03-2022 | 31-03-2023 | 3143-2022 |
| | (Rafer Notes below) | Audited | Unaudited | Aidted | Auftet | Audited | Audited | Unsalited | Audited | Audited | Audited |
| 1 | Total Income from Operations Invt1 | 1,151,48 | 1,008.50 | 1,090.94 | 4,020.80 | 1.384.35 | 1,151.48 | 1,018.85 | 1,114.93 | 4,033,25 | 1.397.40 |
| 7 | Net Profit; (Lass) for the period Before Tao, Exceptional items | (128.29) | 20.21 | (102.10) | 1.74 | (406.88) | (178.09) | 3.56 | 852.290 | (68.32) | (396.45) |
|) | Net Profit (Loss) for the period before tax (after Exceptional Items) | (48.70) | 20.21 | (102.10) | 88.74 | (400.86) | (155.03) | 4.64 | (74,28) | (17.30) | (390.80) |
| 4 | Net Profit Good for the period after tax fafter Exceptional Items | (73.30) | (1.44) | (70.79) | (14.00) | (314.59) | (170,173 | (12,83) | (42.43) | (124.50) | (295.82) |
| 5 | Net Prefit/Less) from discontinued operations after tax | (53.81) | (5.54) | 48.85 | (135,58) | 297.19 | (53.61) | (5.50) | 46.82 | (135.58) | 297,19 |
| 6 | Total Comprehensive Incurse for the period (Comprising Profit) (Local for the period (after too) and Other Comprehensive Income (after too)) | 1120.45 | (7.10) | (26.23) | (162,62) | (75-53) | (273.62) | :18.58) | 1.32 | 280.46 | 2.48 |
| 7 | "Equity Share Capital: (Face Value of ₹ 1)- per share)" | 1,000,10 | 1,91.11 | 3,911.11 | 1,911.11 | 1,00.11 | 1,311.3 | 1.01.11 | 1.011.11 | 1,901.31 | 1,011,13 |
| 8 | Reserves inschaling Revaluation Reserve) as allown in the Audited Salance Short of the provious year | - | - | - 1 | 8,297.92 | E.450.54 | | - | | 8.349.20 | 6,600.64 |
| 9 | Earning per share of C 11- each thors Continuing and Discontinuing Operational | - 111 | | | | | | 27217 | | 1111111 | |
| Т | Bissic and diluted EPS before Exceptional items (E). Continuing operations | (0.08) | (000) | 65,040 | 10.0% | (0.17) | 6.10 | (0.01) | 8.03 | 0.00 | 6.16 |
| | finite and district EPS before Exceptional times (5). Discontinuing operations | (0.03) | (0.00) | 0.03 | (0.07) | 0.18 | (0.00) | (0.00) | 8.00 | (0.07) | 0.16 |
| | Besix and distrect EPS after Exceptional Items (5) | (0.67) | (0.00) | (0.01) | (6.08) | (10.01) | (0.12) | (0.01) | 1.00 | (0.540) | 0.00 |

e B Ve





